

Seat No. : _____

JF-108

June-2022

M.A., Sem.-II

408 : Economics

(Macro Economic Analysis – II)

Time : 2 Hours]

[Max. Marks : 50

નીચેના પ્રશ્ન નં. 1 થી 8માંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના જવાબ આપો :

1. નાણાંનો પુરવઠો એટલે શું ? નાણાંનો પુરવઠો, નાણાંનો ગુણક અને ઉચ્ચ શક્તિ નાણાં વચ્ચેનો સંબંધ સમજાવો. 14
2. (અ) નાણાંના પુરવઠા અને બજેટ ખાધ વચ્ચેનો સંબંધ સમજાવો. 7
(બ) નાણાંના પુરવઠા અંગેનો RBIનો અભિગમ ચર્ચો. 7
3. નાણાંની માંગ અંગેનો કેઈન્સનો સિદ્ધાંત ચર્ચો. 14
4. બોમલનો નાણાંની માંગ અંગેનો સિદ્ધાંત સમજાવો. 14
5. ફુગાવા અંગેનો કેઈન્સીયન અને નાણાંવાદીઓનો અભિગમ ચર્ચો. 14
6. ટૂંકા અને લાંબાગાળાની ફિલિપ્સ રેખા વિગતે સમજાવો. 14
7. વ્યાપાર ચક્ર એટલે શું ? સેમ્યુલસનનો વ્યાપાર ચક્રનો સિદ્ધાંત ચર્ચો. 14
8. આંતરિક અને બાહ્ય સમતુલાના સંદર્ભમાં મુંડેલ ફ્લેમિંગ મોડેલ સમજાવો. 14
9. ટૂંકમાં જવાબ આપો (ગમે તે ચાર) : 8
 - (1) નાણાંના પુરવઠા M3માં શાનો સમાવેશ થાય છે ? જણાવો.
 - (2) નાણાંની માંગ અંગેનું કેમ્બ્રિજ સમીકરણ જણાવો.
 - (3) ફુગાવાજન્ય ખાધ એટલે શું ?
 - (4) નાણાંના પુરવઠાના નિર્ધારક પરિબલો જણાવો.
 - (5) વ્યાપાર ચક્રના જુદા-જુદા તબક્કાઓ જણાવો.

Seat No. : _____

JF-108

June-2022

M.A., Sem.-II

408 : Economics

(Macro Economic Analysis – II)

Time : 2 Hours]

[Max. Marks : 50

Answer any **three** questions from question no. **1** to **8** :

1. What is money supply ? Explain the relationship among money supply, money multiplier and high powered money. 14
2. (a) Explain the relationship between money supply and budget deficit. 7
(b) Discuss RBI approach about money supply. 7
3. Discuss Keynes's theory of Demand for Money. 14
4. Explain Baumol theory of Demand for Money. 14
5. Discuss Keynesian and Monetarist approaches about inflation. 14
6. Explain the Short run and Long run Phillips curve in detail. 14
7. What is trade cycle ? Discuss Samuelson's Theory of the Trade Cycle. 14
8. Explain the Mundel – Fleming model in terms of internal and external equilibrium. 14
9. Answer briefly (Any **four**) : 8
 - (1) What is included in M3 money supply ? Explain.
 - (2) State the Cambridge equation of Demand for Money.
 - (3) What is an inflationary deficit ?
 - (4) State the determinant factors of Money Supply.
 - (5) Describe the different phases of a business cycle.